

09 નવેમ્બર 2018

## બ્રેમ્પટન ખાતે વિન્ટર લાઈટ્સ વીકેન્ડ - 16 થી 18 નવેમ્બર

બ્રેમ્પટન, ઓન્ટારિયો – બ્રેમ્પટનમાં સૌથી રોમાંચક સમયનાં આગમનની તૈયારી છે - રજાઓની ઝલતુ આવી ગઈ!

સીટી ઓફ બ્રેમ્પટન સત્તાવાર રીતે 2018ની રજાઓની ઝલતુનો પ્રારંભ વિન્ટર લાઈટ્સ વીકેન્ડથી કરશે, જેમાં 16 થી 18મી નવેમ્બર સુધી રોમાંચથી ભરપૂર એવાં વિવિધ ઇવેન્ટ્સ થશે.

### હોલિડે પોપ-અપ શોપિ

સીટી ઓફ બ્રેમ્પટન ખાતે સહુ પ્રથમ વખત થનાર ઈન્ડોર હોલિડે પોપ-અપ શોપિ માટે તૈયાર રહેશો, જેમાં સીટી હોલ એટ્રિઅમ અને કન્ઝર્વેટરીમાં અનન્ય કહી શકાય એવા વિકેતાઓ હશે જ્યાં સર્જાણે અનુપમ ભેટ સોગાદો, લહેજતદાર વાનગીઓ એક જ સ્થળે મેળવવા માટેની જગ્યા અને આખા પરિવાર માટે વિન્ટર વન્ડરલેન્ડ જેવું વાતાવરણ. આ વર્ષનું બજાર વિવિધ તહેવારલક્ષી લાક્ષણિકતાઓનું ગૌરવ લેશે જેમકે મેક-યોર-ઓન ઓર્નામેન્ટ સ્ટેશન, ગરમાગરમ એપલ સાઈડર અને પ્રતિભાશાળી કેરોલ (એટલેકે નાતાલના પ્રાર્થનાગીત) ગાયકો.

- શુક્રવાર, 16 નવેમ્બરના રોજ સાંજે 6 થી 10
- શનિવાર, 17 નવેમ્બરના રોજ સવારે 10 થી રાત્રે 10
- રવિવાર, 18 નવેમ્બરના રોજ સવારે 11 થી સાંજે 3

મનોરંજનના લાઈન-અપ અને વિકેતાઓની સૂચિ સહિતની વધુ વિગતો માટે [અહીં](#) ક્લિક કરો.

### વાર્ષિક ટ્રી લાઈટિંગ સેરેમની

વાર્ષિક ટ્રી લાઈટિંગ સેરેમની બ્રેમ્પટનની રજાઓની ઝલતુની ઉજવણીનો સત્તાવાર પ્રારંભ ગણવામાં આવે છે. સહિયારા, બધાં બ્રેમ્પટનવાસીઓ સીટીના 60 ફુટ ઊંચા સ્પ્રુસના વૃક્ષની રોશની શરૂ કરવા ઉંઘી ગણતરી કરશે, જે કેન ટિલ્લાન્સ સ્ક્વેરમાં નાતાલની 10,000 રોશનીઓથી ઝળહળી ઉઠશે. આ નિઃશુલ્ક ઇવેન્ટમાં બી જાઝેડ (B. Jazzed) દ્વારા ક્યુરેટ થયેલ સંગીતમય મનોરંજન અને સમગ્ર પરિવાર માટે શ્રેણીબદ્ધ ઈન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

- શુક્રવાર, 16 નવેમ્બરના રોજ સાંજે 6 થી 8

મનોરંજનના લાઈન-અપ અને બંધ કરાયેલ માર્ગોની માહિતી સહિતની વધુ વિગતો માટે [અહીં](#) ક્લિક કરો.

### બ્રેમ્પટન સાન્તા ક્લોઝ પરેડ

બ્રેમ્પટનની સૌથી લાંબી ચાલતી આવેલી પરંપરા એટલે બ્રેમ્પટનની વાર્ષિક સાન્તા ક્લોઝ પરેડ જે રિજન ઓફ પીલ ખાતેની સૌથી વિશાળ એક દિવસીય ઇવેન્ટ છે અને સમગ્ર કેનેડામાં સૌથી વિશાળ રાત્રિના સમયે થતી પરેડ ગણવામાં આવે છે. પરેડમાં આવવું તથા સાન્તા મહોદય અને મહોદયાનું બ્રેમ્પટનમાં સ્વાગત કરવાનું ચુકશો નહીં. ઝગમગતી રોશની, ફ્લોટ્સ, માર્ચિંગ બેન્ડ્સ, કોસ્ટ્યુમ પહેરેલા નટો અને બીજું ઘણું બધું.

- શનિવાર, 17 નવેમ્બરના રોજ સાંજે 5 થી 7

પરેડના રૂટ, પરેડનો ઈતિહાસ અને બંધ કરાયેલ માર્ગોની માહિતી સહિતની વધુ વિગતો માટે [અહીં](#) ક્લિક કરો.

### સાન્તા મહોદય અને મહોદયા સાથેના ફોટા

સીટી હોલમાં આવો અને સાન્તા ક્લોઝ મહોદય અને મહોદયા સાથે ફોટા પડાવો. ફોટા માટે પોઝ આપવા માટે બધાંનું સ્વાગત છે!

- રવિવાર, 18 નવેમ્બરના રોજ સવારે 11 થી સાંજે 3

તમને વિન્ટર લાઈટ્સ વીકેન્ડના ઈવેન્ટ્સનું આખું સમયપત્રક [અહીં](#) મળશે.

સપ્તાહના અંતિમ દિવસોમાં નિઃશુલ્ક પાર્કિંગ ઉપલબ્ધ કરાશે, જેની શરૂઆત શુક્રવારના રોજ સાંજે 7થી થશે જે ડાઉનટાઉન ખાતેના નગરપાલિકાના તમામ ગેરેજોમાં હશે: સીટી હોલ, વેસ્ટ ટાવર, નેલ્સન સ્ક્વેર, જોહ્ન સ્ટ્રીટ અને રોઝ થિએટર.

દરેક જાણેને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તેઓ પીલ રિજનલ પોલિસ ટોચ ફોર ટોટ્સની ઝુંબેશના સમર્થનમાં ભેટ આપવા હેતુ એક રૅપર કાઢેલું રમકડું લેતા આવે અથવા તો બગડી ન જાય એવી ખાવાની વાનગીઓ જેનું દાન બ્રેમ્પટન ખાતેની ફુડ બેંક્સમાં કરાશે. સપ્તાહના અંતિમ દિવસોમાં દાન સીટી હોલના મુખ્ય દ્વાર પર આપી શકાશે.

### ક્વોટ:

વિન્ટર લાઈટ્સ વીકેન્ડ એટલે બ્રેમ્પટન ખાતેની રજાઓની ઋતુની સત્તાવાર શરૂઆત અને સીટી હોલ કેમ્પસમાં આપનું આતિથ્ય કરવા અમે સહુ ઉત્સુક છીએ! આ વર્ષના વિન્ટર લાઈટ્સ વીકેન્ડમાં દરેક વ્યક્તિ માટે કંઈકને કંઈક છે – રોશની, મ્યુઝિક, નૃત્ય અને બીજું ઘણું બધું. અમને ખાતરી છે કે આપ આ ગમ્મત ચુકશો નહીં."

- *બૉબ ડાર્લિંગ, ડાયરેક્ટર, બ્રેમ્પટન ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર*

-30-

**બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે.** અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક :

ક્રિસ્ટિન શર્મા (Christine Sharma)

મિડિયા રિલેશન્સ

સીટી ઓફ બ્રેમ્પટન

905.874.2880 | [christine.sharma@brampton.ca](mailto:christine.sharma@brampton.ca)